

તે એ છે કે જેણે શ્રેષ્ઠ આચરણ માટે તમારામાં સહ સ્પર્ધાને પ્રોત્સાહન આપવા ઝંખત અને પૃથ્વીનું સર્જન કર્યું છે

હજ ફંડ ઓફ ઇન્ડિયા™

ઝકાત ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા® દ્વારા સ્થાપિત અને સંચાલિત

ઝકાત હાઉસ, D-2, ઓખલા વિહાર, જામિયા નગર, નવી દિલ્હી 110025 (ભારત)

hajfundofindia@zakatindia.org • www.zakatindia.org/HajFund.html

નીતિવિષયક નિવેદન

1. હજ ફંડ ઓફ ઇન્ડિયામાં કોઇ પણ ભારતીય મુસ્લિમને તેના/તેણીના નામે અથવા અન્ય કોઇ પણ ભારતીય મુસ્લિમના નામે હજ એકાઉન્ટ, એટલે કે હજ ખાતું ખોલવવા આમંત્રણ છે, તેમાં ઉંમર અથવા જાતિ અથવા આવી કોઇ પણ વ્યક્તિની અન્ય ઓળખનો કોઇ બાધ નથી.

સ્પષ્ટતા: આ લેખમાં, શબ્દ 'ભારતીય'માં ભારતીય સામાન્ય કાયદામાં સમજ્યા મુજબ, બિન-નિવાસી ભારતીયનો સમાવેશ થાય છે.

2. જે વ્યક્તિના નામે હજ એકાઉન્ટ ખોલવામાં આવે છે તેને હજ એકાઉન્ટ હોલ્ડર (HAH) એટલે કે હજ ખાતાધારક તરીકે ઓળખવામાં આવશે
3. વ્યક્તિ (HAH સિવાયની અન્ય વ્યક્તિ) કે જે હજ એકાઉન્ટમાં નાણા જમા કરાવે છે તે હજ એકાઉન્ટ ડિપોઝિટર (HAD) એટલે કે હજ ખાતા થાપણદાર તરીકે ઓળખવામાં આવશે
4. HAH અથવા HAD દ્વારા રૂ. 1,000/- (રૂપિયા એક હજાર) અથવા વધુની રકમ જમા કરાવીને એકાઉન્ટ ખોલાવી શકાય છે.
5. હજ એકાઉન્ટમાં, HAH અથવા HADની પસંદગી મુજબ 1,000/-, 2,000/-, 3,000/-, 4,000, 5,000/- અથવા રૂ. 1,000/-ના ગુણાંકમાં અન્ય કોઇ પણ રકમ નિયમિત રીતે (દર મહિને વધુ પસંદનીય) જમા કરાવી શકાય છે
6. હજ એકાઉન્ટમાં રૂ. 1,01,000 (આ રકમ ZFIના બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા પ્રવર્તમાન ભાવ સૂચકાંક, HAHને હજ કરવા માટે જરૂરી લઘુત્તમ રકમ જેવા પરિબલોને આધારે તેની મનસૂઝી મુજબ બદલાઇ શકે છે) અથવા વધુ રકમ જમા થયા બાદ, HAH, હજ પર જવાના ઉદ્દેશ માટે તેના અથવા તેણીના હજ એકાઉન્ટમાંથી રૂ. 1,00,000/- (રૂપિયા એક લાખ અથવા એક સો હજાર) સુધીની અથવા વધુ રકમ (જે તે કિસ્સાને આધારે) ઉપાડવા મુક્ત હશે અને તેના અથવા તેણીના હજ એકાઉન્ટમાં રૂ. 1,000/-ની લઘુત્તમ રકમ અકબંધ રાખશે.

*હજ ફંડ ઓફ ઇન્ડિયા' ઝકાત ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા ડ્રેડમાર્કડ કરાયેલું છે.

હજ ફંડ ઓફ ઇન્ડિયા™

7. તે વખતે, જો HAH દ્વારા યોગ્ય HFI કાર્યવાહી મારફતે તેમ ઇચ્છા વ્યક્ત કરવામાં આવે તો, HFI વિનંતી કરાયેલી રકમ HAH અથવા સેન્ટ્રલ હજ કમિટી ઓફ ઇન્ડિયા અથવા ભારતીય રાજ્યની હજ કમિટી, વગેરે જેવી સંસ્થાને તાત્કાલિક ચુકવવા બંધાયેલું રહેશે.
8. જોકે, હજ એકાઉન્ટ ચાલુ રાખવા માટે ખાતામાં લઘુત્તમ રૂ. 1,000/-ની રકમ રાખવી આવશ્યક છે.
9. HAH હજ કરીને આવે ત્યાર બાદ પણ, તેનું અથવા તેણીનું હજ એકાઉન્ટ, HAH અથવા HADની પસંદગી મુજબ થાપણો મેળવવાનું ચાલું રાખી શકે છે.
10. હજ એકાઉન્ટમાં HAHનું ક્રેડિટ બેલેન્સ નીચે દર્શાવેલી રકમ કરતા વધી જાય ત્યાર બાદ
 - (a) રૂ. 1,21,000/-, એવા HAHના કિસ્સામાં કે જેણે હજ સુધી હજ કરવાની બાકી છે અને HFIમાં તેનું/તેણીનું ક્રેડિટ બેલેન્સ વાપરે છે અથવા
 - (b) રૂ. 21,000/-, એવા HAHના કિસ્સામાં કે જેણે HFIમાં તેના/તેણીના ક્રેડિટ બેલેન્સનો ઉપયોગ કરીને હજ કરી છે, તો HAH તેના અથવા તેણીના શરિયત સુસંગત અંગત ઉદ્દેશો માટે રૂ. 20,000/-ની મહત્તમ રકમ ઉપાડવા હકદાર રહેશે.

ZFIના બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા પ્રવર્તમાન ભાવ સૂચકાંક, વગેરે જેવા પરિબલોને આધારે તેની મનસૂઝીને આધારે આ લેખમાં ઉલ્લેખ કરાયેલી રકમમાં ફેરફાર થઈ શકે છે તે શરતને આધિન.

11. ઉપરોક્ત કલમ 6,7 અથવા 10માં ઉલ્લેખ કરાયેલા કોઈ પણ સંજોગોમાં હજ ફંડ વપરાયા બાદ જો HAH અથવા HAD HFIમાં આવી રકમના પૂર્ણ અથવા આંશિક હિસ્સામાં ફરીથી નાણા જમા કરાવવા ઇચ્છે તો તે/તેણી કોઈ પણ વખતે એક અથવા વધુ હપતામાં આમ કરવા આમંત્રિત છે.
12. (a) ZFI કોઈ પણ વખતે, HFIમાંનું ગ્રોસ ક્રેડિટ બેલેન્સ (આવા બેલેન્સના પચાસ ટકાથી વધુ નહીંની હદ સુધી) નીચેના ઉદ્દેશો માટે વાપરવા મુક્ત હશે
 - (i) ગરીબ અથવા જરૂરિયાતમંદ લોકના કલ્યાણ માટે- ZFIના મેમોરેન્ડમ ઓફ એસોસિએશન મુજબ, અથવા
 - (ii) શરિયત સુસંગત રોકાણના ઉદ્દેશ માટે, ઉલેમા/મુક્તિ સાથે પરામર્શ કર્યા બાદ.

(b) આવા રોકાણમાંથી મેળવેલા અથવા એકત્ર થયેલા કોઇ પણ નાણાકીય લાભનો ગરીબ અથવા જરૂરિયાતંદ લોકોના કલ્યાણ માટે ઉપયોગ થશે- ZFના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશન મુજબ.

(c) આવા રોકાણમાંથી થતા કોઇ પણ ગેરલાભને ZF દ્વારા શોષવામાં/ઉઠાવવામાં આવશે અને કોઇ પણ HAH પર આવા સંભવિત કોઇ પણ ગેરલાભની અસર નહીં થવા દેવાય, સિવાય કે HAH વિપરિત વિકલ્પ પસંદ કરે.

હજ ફંડ ઓફ ઇન્ડિયા™

13. દરેક HAH સલામતી અને અંગતતાની યોગ્ય પ્રક્રિયા અનુસર્યા બાદ કોઇ પણ વખતે તેના અથવા તેણીના હજ એકાઉન્ટનો ઓનલાઇન અથવા આ ઉદ્દેશ માટે ZFને કરેલી અરજી મારફતે ઉપયોગ કરવા હકદાર હશે.

14. IHFની વ્યાપક રૂપરેખા ZFની વેબસાઇટ પર પ્રદર્શિત કરવામાં આવશે.

15. આ સેવામાં સુધારો કરીને તેને વધુ ચુઝર ફેન્ડલી અને શરિયત સુસંગત બનાવવા માટે સૂચનો આવકાર્ય છે.

[સમાપ્ત]